

RAN-2408000604020006
S. Y. B. Com. (Sem. - IV) Examination April - 2026
Major - Banking Law and Practice - III
સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (ગમે તે પાંચ) (10)
- ચેકનું કોસિંગ એટલે શું?
 - ચેકની વસુલાત એટલે શું?
 - કયા સંજોગોમાં ચેકનો નકાર થાય છે?
 - CIBIL સ્કોરનું આખું નામ જણાવો.
 - CASA ડિપોઝિટ એટલે શું?
 - યથાનુક્રમે ચુકવણી એટલે શું?
 - લોન નો અર્થ સમજાવો.
- પ્ર. 2. સંગીન બેંક ધિરાણના સિદ્ધાંતો સમજાવો. (14)
- અથવા
- પ્ર. 2. ચેકના નાણાં ચૂકવનાર બેંકરની ફરજો વિગતવાર સમજાવો. (14)
- પ્ર. 3. (અ) લોન માટેના છુપા ચાર્જસ (Hidden Charges) વિગતવાર ચર્ચો. (07)
- (બ) બેંકો માટે CASA ડીપોઝિટનું મહત્વ ચર્ચો. (07)
- અથવા
- પ્ર. 3. (અ) વસુલાત બેંકરની ફરજો ચર્ચો. (07)
- (બ) સિબિલ સ્કોર (CIBIL Score)નું મહત્વ સમજાવો. (07)
- પ્ર. 4. (અ) ગમે તે એક પ્રશ્નનો જવાબ આપો. (06)
- ટૂંકનોંધ લખો : ચાલુ ખાતું
 - તફાવત સ્પષ્ટ કરો : રક્ષિત ધિરાણ અને બિનરક્ષિત ધિરાણ.
- (બ) નીચેના સંજોગોમાં બેંકર તરીકે તમે શું કરશો? (06)
- ચુકવણી માટે રજૂ થયેલ ચેકની રકમ આંકડામાં અને શબ્દોમાં સમાન નથી.
 - આપનો એક ગ્રાહક આપને જણાવે છે કે તેનો આવતા અઠવાડિયે રજૂ થનાર ચેક ખોવાય ગયો છે.

ENGLISH VERSION

- Q. 1. Answer the following in short. (Any five) (10)**
1. What is meant by crossing of a cheque?
 2. What is meant by collection of cheque?
 3. In which circumstances a cheque is dishonoured?
 4. Give the full form of CIBIL.
 5. What are CASA deposits?
 6. What is meant by payment in due course?
 7. Give the meaning of Loan.
- Q. 2. Discuss the Principles of Sound lending. (14)**
- OR**
- Q. 2. State the duties of Payment Banker in detail. (14)**
- Q. 3. (A) Describe the hidden charges related to the loan. (07)**
- (B) State the importance of CASA Deposits for Banks. (07)**
- OR**
- Q. 3. (A) Discuss the Duties of Collecting banker. (07)**
- (B) Explain the importance of CIBIL score. (07)**
- Q. 4. (A) Answer any one from the following. (06)**
1. Write a short note: Current account.
 2. Distinguish: Secured loan and Unsecured loan
- (B) What would you do as a banker in the following situations? (06)**
1. A cheque is presented in which the amount written is not same in words and digit.
 2. One of your customers informs you that he has lost a cheque which will be presented on next week.
-